

કોવિડ-૧૯ મૃત્યુના કિસ્સામાં સુરત મહાનગરપાલીકા અને સુરત જિલ્લા(ગ્રામ્ય) વિસ્તાર માટે અરજદારશ્રીઓએ નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે.

કોવિડ -૧૯ થી થયેલ મૃત્યુના પ્રમાણપત્રો એકત્રીત કરવા.

- (૧) આર.ટી.પી.સી.આર/ રેપીડ એન્ટીજન ટેસ્ટ/મોલેક્યુલર ટેસ્ટ (કોરોના ટેસ્ટ) થયેલ હોય તેની નકલ
- (૨) મૃત્યુની નોંધણી અંગેનું પ્રમાણપત્ર (દાખલો)ની નકલ ઉપલબ્ધ ન હોય તો જ્યાં મરણ થયું હોય તે વિસ્તારના જન્મ - મરણ નોંધણી અધિકારીશ્રીની કચેરીએથી મેળવી લેવાના રહેશે.
 - ❖ સુરત મહાનગરપાલીકા વિસ્તારમાં મરણ થયેલ હોય તો જ્યાં મરણ નોંધાવેલ હોય તે શહેરી જન્મ-મરણ નોંધણી કચેરી, મુગલીસરા/ નજીકની ઝોન ઓફિસ ખાતેથી મેળવવાનું રહેશે.
 - ❖ ગ્રામ્ય વિસ્તારમાં મરણ થયેલ હોય તો જ્યાં મરણ નોંધાવેલ હોય તે સંબંધિત તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામ પંચાયત કચેરી તથા ચીફ ઓફીસરશ્રી સંબંધિત નગર પાલીકા નોટીફાઇડ (INA) વિસ્તાર પાસેથી મેળવી લેવાનું રહેશે.
- (૩) નીચે જણાવેલ (A) (B) અથવા (C) માંથી લાગુ પડતુ કોઇ પણ એક
 - (A) મેડીકલ સર્ટીફિકેશન ઓફ કોઝ ઓફ ડેથ (MCCD) ફોર્મ - ૪ મૃત્યુનું કારણ દર્શાવતું તબીબી પ્રમાણપત્ર જે હોસ્પિટલમાં મૃત્યુ થયેલ હોય તે હોસ્પિટલ માંથી પ્રમાણીત નકલ (ડોક્ટરના સહી સિકકા સાથે) મેળવવાની રહેશે.
 - (B) ઘરે મૃત્યુના કિસ્સામાં મૃત્યુ અંગેનું પ્રમાણપત્ર જે તે હોસ્પિટલ અથવા ખાનગી તબીબી અધિકારી પાસેથી ફોર્મ-૪(એ) પ્રમાણીત નકલ (ડોક્ટરના સહી સિકકા સાથે મેળવવાની રહેશે.)
 - (C) ઉપરોક્ત બન્ને કિસ્સામાં મૃત્યુના કારણ અંગેનું ડોક્ટરી પ્રમાણપત્ર ફોર્મ-૪ અથવા ફોર્મ- ૪(A) મળેલ/ઉપલબ્ધ ન હોય અથવા મળેલ પ્રમાણપત્ર સામે વાંધો હોય તે કિસ્સામાં અરજદારે COVID - 19 Death Ascertaining Committee (CDAC) સમક્ષ અરજી કરવાની રહેશે.

જે માટે નીચે જણાવેલ સ્થળ પરથી તેનું નિયત નમુનાની અરજી પત્રક (પરિશિષ્ટ-૩) મેળવી શકાશે.

સુરત મહાનગરપાલીકા (SMC) માટે નજીકના ઝોન ઓફિસ ખાતેથી અથવા જિલ્લા કલેક્ટર કચેરીની અધિકૃત વેબસાઇટ <https://surat.gujarat.gov.in/> અને સુરત મહાનગરપાલીકાની વેબસાઇટ <https://www.suratmunicipal.gov.in/> ઉપરથી પણ ડાઉનલોડ કરી શકાશે. ઉપરથી નિયતનમુના (પરિશિષ્ટ-૩) મેળવી લેવાનું રહેશે. સુરત જિલ્લા (ગ્રામ્ય) માટે સંબંધિત તાલુકા મામલતદાર કચેરી ખાતેથી મેળવી લેવાનું રહેશે,

જે પરીશિષ્ટ-૩ માં દર્શાવેલ બિડાણ (ચેકલીસ્ટની યાદી) મુજબ અથવા નીચે જણાવેલ દસ્તાવેજો સામેલ કરી અરજી તે જ કચેરીમાં કરવાની રહેશે.

- (૧) મરણનું પ્રમાણપત્ર
- (૨) અપ્રાપ્ય પ્રમાણપત્ર અથવા હોસ્પિટલ/ ખાનગી તબીબ ધ્વારા અપાયેલ (ફોર્મ-૪ અથવા ફોર્મ-૪(એ)ની પ્રમાણીત (ડોક્ટરના સહી સિકકા સહીત) નકલ
- (૩) ઇન્ડોર કેસ પેપર્સ (દાખલ થયેલ દર્દના કિસ્સામાં)
- (૪) ઘરે મૃત્યુના કિસ્સામાં દર્દીએ સ્થાનિક તબીબની સારવાર લીધી હોય તેની વિગતો તથા આધાર પુરાવા
- (૫) દર્દીના કરવામાં આવેલ વિવિધ પરિક્ષણ જેવા કે (લેબોરેટરી પરિક્ષણ, રેડીયોલોજી પરિક્ષણના પુરાવા)

કોવિડ - ૧૯ સહાય મેળવવા બાબતે માર્ગદર્શિકા

- ❖ કોવિડ-૧૯ના મૃત્યુ અંગેની સહાય મેળવવા બાબતે ઉપર મુજબ જરૂરી કોવિડ દસ્તાવેજ/પુરાવા એકત્ર કરી અરજદારે તા.૨૦/૧૧/૨૦૨૧ ના ઠરાવમાં નિયત થયેલ ફોર્મ સુરત મહાનગરપાલિકા વિસ્તાર (SMC) માટે નજીકના ઝોન ઓફિસ ખાતે તેમજ સુરત જિલ્લા (ગ્રામ્ય) માટે સંબંધિત તાલુકા મામલતદાર કચેરીમાંથી અથવા <https://surat.gujarat.gov.in/> અથવા <https://www.suratmunicipal.gov.in/> માંથી ડાઉનલોડ કરી વિગત ભરીને નીચે મુજબના પુરાવાઓ સામેલ રાખી અરજી
- સુરત મહાનગરપાલિકા (SMC) વિસ્તાર માટે નજીકના ઝોન ઓફિસ ખાતે
 - સુરત જિલ્લા (ગ્રામ્ય કક્ષાએ) મામલતદાર કચેરી ખાતે આપવાની રહેશે.

સહાયની અરજી સાથે સામેલ રાખવાના પુરાવાઓ

1. મૃતકના મરણનું પ્રમાણપત્ર,
2. ફોર્મ-૪(હોસ્પિટલમાં મૃત્યુ થયું હોય તો), / ફોર્મ-૪-એ(અન્ય કિસ્સામાં મૃત્યુ થયું હોય તો)
3. RTPCR રિપોર્ટ,
4. આધારકાર્ડ,
5. વારસદારની બેંક ખાતાની વિગત,
6. એક જ વારસદાર હોય તો સાદા કાગળ પર ડેકલેરેશન/એક થી વધુ વારસદાર હોય તો અન્ય વારસદારની સંમતિ સાથેની એફિડેવિટ જોડવાની રહેશે.